



આરોગ્ય વિભાગ
વડોદરા મહાનગરપાલિકા
www.vmc.gov.in
ભરતી અંગેની જાહેરાત

વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત 24x7 અર્બન પીએચસી ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગથી નીચે જણાવેલ જગ્યાઓ પર ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.-૨૫/૦૨/૨૦૨૨ (૧૩.૦૦ કલાક) થી તા. ૧૧/૦૩/૨૦૨૨ (૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

ક્રમ	જગ્યાનું નામ	કુલ જગ્યા
૧	મીડ વાઇફરી (NPM) - કરાર આધારીત	૧૧
૨	આયાબેન (Class-4) -આઉટ સોર્સિંગ	૯
૩	સિક્યોરિટી ગાર્ડ- આઉટ સોર્સિંગ	૧૧
૪	પટાવાળા- આઉટ સોર્સિંગ	૨

(૧) કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. (૨) આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજૂર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ ૨ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ડે.મ્યુનિસિપલ કમિશનર પી.આર.ઓ. નં ૧૦૩૦/૨૧-૨૨ વડોદરા મહાનગરપાલિકા



આરોગ્ય વિભાગ
વડોદરા મહાનગરપાલિકા

ભરતી માટેની જાહેરાત
(જાહેરાત ક્રમાંક: ૧૦૩૦/૨૦૨૧-૨૨)

ક્રમ	જગ્યાનું નામ	કુલ જગ્યા	શૈક્ષણિક લાયકાત	ફિક્સ પગાર (પ્રતિ માસ)
૧	મીડ વાઇફરી(NPM) -કરાર આધારીત	૧૧	(૧)ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બેસિક બીએસસી કે પોસ્ટ બેસિક બીએસસી(નર્સિંગ)ની ડીગ્રી અથવા (૨) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ અને મીડવાઇફરી નો ડીપ્લોમા કોર્સ અને (૩) ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી નર્સ પ્રેક્ટીશનર મીડવાઇફરી નો પોસ્ટ બેઝીક ડીપ્લોમા કોર્સ- ફરજિયાત (૩) માન્ય સંસ્થામાંથી કરેલ કોમ્યુટરનો કોર્સ	૩૦૦૦૦/- +ઇન્સેન્ટીવ
૨	આયાબેન (class-4) (Out Sourcing)	૯	ઓછામાં ઓછું ૮ ધોરણ પાસ, ૩ વર્ષનો અનુભવ	૮૫૦૦/-
૩	સિક્યોરિટી ગાર્ડ (Out Sourcing)	૧૧	ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય	૮૫૦૦/-
૪	પટાવાળા (Out Sourcing)	૨	ઓછામાં ઓછું ૮ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય	૮૫૦૦/-

જાહેરાતની સામાન્ય જોગવાઈઓ:

1. ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.
2. રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૨૫/૦૨/૨૦૨૨ (૧૩-૦૦ કલાક) થી તા. ૧૧/૦૩/૨૦૨૦(૨૩-૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.
3. **શૈક્ષણિક માહિતી:** દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ **education qualification details** માં ના હોય તો **OTHER1** અને કોમ્પ્યુટર કોર્સ ની માહિતી **OTHER2** માં ભરવી.
4. **વયમર્યાદા:** ૫૮ વર્ષ થી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
5. ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
6. ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ.
7. ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે.
8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે.
9. આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
10. પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.
11. આ જાહેરાત કોઈ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.
12. ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

તા. ૨૪/૦૨/૨૦૨૨

ડે.મ્યુનિસિપલ કમિશ્નર(વ)
વડોદરા મહાનગરપાલિકા